

પાંડેસરા પો.સ્ટે.માં નોંધાયેલ છોકરીના મર્ડર કેસ અંગે બીજા સહ આરોપીની ધરપકડ કરતી સુરત ડી.સી.બી.પોલીસ.

પાંડેસરા પો.સ્ટે. । ગુ.ર.નં. ૮૯/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૨૩, ૩૭૬(૨) (આઇ) (જે) (એમ), તથા ધી પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ ૨૦૧૨ ની કલમ ૫(આઇ) (એમ) ૬ મુજબ તથા પાંડેસરા પો.સ્ટે. । ગુ.ર.નં. ૯૪/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧ મુજબનો ગુનો તા.૦૯/૦૪/૨૦૧૮ ના રોજ નોંધાયેલ. આ ગુનામાં સંડોવાયેલ આરોપી હરસહાય રામરાજ ગુર્જર ઉ.વ.૨૭ રહે.૧૧૭-૧૧૮, સોમેશ્વર નગર-૧, ભેસ્તાન જીયાવરોડ, પાંડેસરા, સુરત શહેરને અટક કરેલ.

આ ગુનાઓની તપાસમાં સહઆરોપી હરીઓમ ઉર્ફે બુઢા ડ/૦ હીરાલાલ ગુર્જર ઉ.વ.૨૪ ધંધો:-મજૂરીકામ રહે. રહે.૧૧૭, ૧૧૮, સોમેશ્વર નગર વિ-૧, શક્તિ વિદ્યાલય સ્કુલની સામે, ભેસ્તાન, જીયાવ રોડ, પાંડેસરા, સુરત મુળવતન:-કુનેકટા ખુર્દ, પોસ્ટ:-અમરગઢ ચોકી, થાના:-ગંગાપુર સીટી, તા.ગંગાપુર જી.સવાઇ માધોપુર (રાજસ્થાન) વાળાને રાજસ્થાન તપાસમાં ગયેલ પોલીસ ટીમે પકડી લાવી તા.૦૭/૦૫/૨૦૧૮ ના રોજ કલાક:-૧૫/૦૦ વાગે અટક કરવામાં આવેલ છે અને સદર આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરતા તા. ૧૦/૦૫/૨૦૧૮ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર સોપેલ હોય સદર આરોપી હાલ રીમાન્ડ ઉપર છે અને ગુનાની તપાસ ચાલુ છે.

ડાંગ જીલ્લાના વઘઇ પો.સ્ટે. ખાતે દાખલ થયેલ ખુનનો વણશોધાયેલ ગુન્હો સુરત શહેર, કાઇમ બ્રાંચ પોલીસની મદદથી શોધી કાઢતી ડાંગ પોલીસ.

તા.૨૮/૦૪/૨૦૧૮ ના રોજ મોજે વઘઇ થી સાપુતારા રોડ ઉપર ફંડા ફાટકથી રાજસ્થાની ઢાબા વચ્ચેના રોડ ઉપર આવેલ ગરનાળામાં એક અજાણી સ્ત્રી, ઉ.વ. આશરે ૩૦ થી ૩૫ ની લાશ મળી આવેલ હતી. જે બાબતે વઘઇ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૬/૨૦૧૮ ઇ.પી.કો.કલમ-૩૦૨ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ, સદર ગુનાની તપાસ પો.સ.ઇ. એમ.એલ.ડામોર નાઓ કરતા હોય, આ ગુનામાં મરણ જનાર અજાણી મહિલાની ઓળખ સુરત શહેર, વરાછા વિસ્તારમાં રહેતા ડો.નિલેશભાઇ વસરામભાઇ વિરાણી રહે. બી-૧૦૬, પંચ રત્ન ટાવર, લંબે હનુમાન રોડ, વરાછા, સુરતનાઓની પત્ની બીનાબેન તરીકે ઓળખ જાહેર થયેલ ત્યારબાદ સદર ગુન્હાની વધુ તપાસ માટે ડાંગ પોલીસ દ્વારા પોલીસ કમિશ્નરશ્રી સુરત શહેરનાઓને મદદ માટે વિનંતી કરતા પો.કમિ.શ્રી દ્વારા કાઇમ બ્રાંચને તપાસમાં જોડાવવા સુચના કરેલ અને ઇન્ચાર્જ ડી.સી.પી. કાઇમ શ્રી બિપીન આહીરેને સુપરવિઝન કરવા જણાવેલ જેથી, સુરત કાઇમ બ્રાંચ અને ડાંગના પોલીસ અધિકારીઓ સાથે મળી, સુરત શહેર વિસ્તારમાં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી કેમેરાના ફુટેજોની ચકાસણી કરી તેમજ ટેકનિકલ ટીમ મારફતે મરણ જનારના મોબાઇલ નંબરની કોલ ડીટેઇલ મેળવી એનાલિસીસ કરતા, શંકાસ્પદ ઇસમોની તપાસ કરવામાં આવેલ હતી. સદર મહીલાની હત્યામાં સદરહુ મહીલાના મિત્ર (૧) સંજય ભાનુભાઇ ડોબરીયા ઉ.વ.૩૬ રહે.એ/૨૩/સાગર સોસા., નિલકમલ પાર્ક સોસા.ની સામે, મરઘા કેન્દ્રની પાસે એલ.એચ.રોડ, કાપોદ્રા, સુરત તથા (૨) તારીક અબ્દુલરજાક શેખ ઉ.વ.૨૭ હાલ રહે. લસકાણા, સુરત મુળ રહે. ગામ ચોસાલા, આઝાદ ગલી તા.જી. બીડ(મહારાષ્ટ્ર) નાઓ સંડોવાયેલા હોવાના પુરાવા મળતા કાઇમ બ્રાંચ સુરત શહેરનાઓએ બન્ને આરોપીને અટક કરેલ આ કામગીરીમાં કાઇમબ્રાંચના શ્રી. વી.વી.ભોલા, પો.સ.ઇ. શ્રી. પી.કે.પટેલ તથા ડાંગ જીલ્લાના પો.સ.ઇ.શ્રી મકવાણા તથા પો.સ.ઇ.શ્રી ડામોર નાઓની પોલીસ ટીમોએ કરેલ છે. આ ગુનો સુરત શહેરની કાઇમ બ્રાંચની મદદથી શોધી શકાયેલ છે અને કાઇમ બ્રાંચે આરોપી સુધી પહોંચી તેઓને પકડી પુછ પરછ કરી આગળની તપાસ માટે ડાંગ પોલીસને સુપ્રત કરેલ છે.